

-: અખબારી યાદી:-

સફાઈ કામદાર (પાર્ટ ટાઈમ) ની કુલ ૪૪૧ જગ્યા માટે ભરતી માટે તમામ વોર્ડ ઓફિસમાં ફોર્મ વિતરણ શરૂ:

સોશિયલ ડિસ્ટન્સ જાળવવાના હેતુથી હવેથી માત્ર પૂર્વ ઝોન અને પશ્ચિમ ઝોનના સિટી સિવિક સેન્ટર તથા તમામ વોર્ડ ઓફિસ ('અ' વિભાગ) ખાતેથી ફોર્મ વિતરણ: બપોરે ૦૧:૦૦ વાગ્યા આસપાસ અરજદારોની સંખ્યા નહીવત

તારીખ: ૨૨-૦૭-૨૦૨૦

હાલમાં રાજકોટ શહેરમાં ભળેલા નવા વિસ્તારોની સફાઈ કામગીરીને સુઢઢ બનાવવા માટે આજે તા.૨૧/૦૭/૨૦૨૦ થી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટમાં રોજમદાર સફાઈ કામદાર (પાર્ટ ટાઈમ) ની કુલ ૪૪૧ જગ્યા માટે ભરતી પ્રક્રિયા અન્વયેના અરજી ફોર્મનું વિતરણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિના-મુલ્યે વિતરણ શરૂ કરવામાં આવેલ છે. આજથી મનપાના પૂર્વ ઝોન અને પશ્ચિમ ઝોનના સિટી સિવિક સેન્ટર તથા તમામ વોર્ડ ઓફિસ ('અ' વિભાગ) ખાતેથી આ અરજી ફોર્મનું વિતરણ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. સેન્ટ્રલ ઝોન કચેરીના સિટી સિવિક સેન્ટર ખાતે વધુ સંખ્યામાં અરજદારો આવતા તેમજ સિટી સિવિક સેન્ટરમાં અન્ય કામો માટે આવતા મુલાકાતીઓની પણ મોટી સંખ્યા ધ્યાને લઈ સેન્ટ્રલ ઝોન કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાના હેતુસર ફોર્મનું વિતરણ બંધ કરવામાં આવેલ છે.

આ ફોર્મ મેળવવા માટે અરજદારે રૂબરૂ તા. ૨૧-૦૭-૨૦૨૦ થી તા. ૧૭-૦૮-૨૦૨૦ સુધીમાં કચેરીના સમય ૧૦:૩૦ થી ૧૪:૦૦ અને ૧૪:૩૦ થી ૧૬:૦૦ કલાક સુધીમાં મેળવી લેવાનું રહેશે. વધુમાં જરૂરી આધાર પુરાવા સાથેના ભરેલ અરજી ફોર્મ તા.૨૭/૦૭/૨૦૨૦ થી તા.૧૮/૦૮/૨૦૨૦, ૧૬:૦૦ કલાક સુધીમાં પૂર્વ ઝોન અને પશ્ચિમ ઝોનના સિવિક સેન્ટર ખાતે જમાં કરાવવાના રહેશે.

અરજી ફોર્મ મેળવવા માટે અરજદારે તેના માતા/પિતા/દાદા/દાદી રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદાર તરીકે કામગીરી કરી નિવૃત્ત થયેલ હોય, તેના પુરાવારૂપે પેન્શન બુકની નકલ અથવા પગાર સ્લીપની નકલ રજૂ કરવાની રહેશે. નિયત સમય બાદ તેમજ રૂબરૂ સિવાયના અન્ય માધ્યમથી રજૂ થતી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. તેમજ તેને રદ કરવામાં આવશે.

ઉપરોક્ત સમગ્ર પ્રક્રિયા વિના મુલ્યે હોય, કોઈપણ પ્રકાર ફી કે ચાર્જ ઉમેદવારે ભરવાનો રહેતો નથી. જેની ખાસ નોંધ લેવી.

(પર્યાવરણ ઈજનેર)

રાજકોટ મહાનગરપાલિકા